



ગુજરાત જાહેર સેવા આયોગ

અગત્યની જાહેરાત

આયોગ દ્વારા આપવામાં આવેલ નીચે મુજબની જાહેરાતો માટે પ્રાથમિક કસોટી તારીખ ૧૮-૧૨-૨૦૧૬ ને રવિવારના રોજ સવારના / બપોરના ગાંધીનગર/ અમદાવાદ ખાતે યોજનાર છે.

ક્રમ	જગ્યાનું નામ	જાહેરાત ક્રમાંક	સમય
૧.	નિયામકશ્રી, સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી ખાતામાં મદદનીશ નિયામક વર્ગ-૨ (ખાસ ભરતી)	૫૦/૨૦૧૬-૧૭	૧૧-૦૦ થી ૧૨-૪૦
૨.	નાયબ બાગાયત નિયામક, વર્ગ-૧	૪૨/૨૦૧૬-૧૭	૦૩-૦૦ થી ૦૪-૪૦
૩.	મદદનીશ બાગાયત નિયામક, વર્ગ-૨	૪૩/૨૦૧૬-૧૭	૧૧-૦૦ થી ૧૨-૪૦
૪.	મદદનીશ નિયામક તાલિમ/ આચાર્ય, વર્ગ-૧	૫૨/૨૦૧૬-૧૭	૦૩-૦૦ થી ૦૪-૪૦
૫.	પ્રોગ્રામ ઓફિસર, વર્ગ-૧	૫૩/૨૦૧૬-૧૭	૦૩-૦૦ થી ૦૪-૪૦

જેઓના અરજીપત્રક કન્ફર્મ થયેલ છે તેવા તમામ ઉમેદવારોને આ કસોટીમાં કામચલાઉ ધોરણે ઉપસ્થિત થવા દેવાનો આયોગે નિર્ણય કરેલ છે. ઉમેદવારોએ તા. ૦૩-૧૨-૨૦૧૬ સમય બપોરે ૧-૦૦ કલાક થી પરીક્ષાના દિવસે જા. ક. ૫૦/૨૦૧૬-૧૭ અને ૪૩/૨૦૧૬-૧૭ માટે સવારના ૯:૦૦ કલાક સુધીમાં તથા જા. ક. ૪૨/૨૦૧૬-૧૭, જા. ક. ૫૨/૨૦૧૬-૧૭ અને જા. ક. ૫૩/૨૦૧૬-૧૭ માટે બપોરના ૧-૦૦ કલાક સુધીમાં પોતાના પ્રવેશપત્ર, હાજરીપત્રક તથા ઉમેદવારોની સુચનાઓ (પરિશિષ્ટ-૧ અને ૨) "on line" ડાઉનલોડ કરવાના રહેશે. પ્રવેશપત્ર "on line" ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ નીચે મુજબ તબક્કાવાર/સ્ટેપવાઈઝ કાર્યવાહી કરવાની રહે છે. (૧) <https://gpsec-ojas.gujarat.gov.in/> પર જવું. (૨) "Print Call Letter" પર "Click" કરવું. (૩) અહીં ઉમેદવારે પોતાની "Job Select" કરવી તથા "Confirmation Number" અને "Birth Date" ટાઈપ કરવાના રહેશે. (૪) હવે "Print Call Letter" પર "Click" કરી પ્રવેશપત્રની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. હાજરીપત્રકમાં નોંધની અંદર પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ પર "Click" કરવાથી ઉમેદવારની સુચનાઓ પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ની પ્રિન્ટ નીકળશે. આ તમામ દસ્તાવેજોની પ્રિન્ટ અચૂક કાઢવામાં આવે તેની નોંધ લેવી. પ્રવેશપત્ર અને હાજરીપત્રક અલગ અલગ કાગળ પર પ્રિન્ટ કરવાના રહેશે. પરીક્ષા સમયે બંને સાથે લાવવાના રહેશે. ફોટાવાળું હાજરીપત્રક પરીક્ષા ખંડમાં પરત સોંપવાનું રહેશે. જે ઉમેદવારોના ફોટા હાજરીપત્રકમાં સ્પષ્ટ જોઈ શકાય તેવા આવેલા ન હોય તેવા ઉમેદવારોએ પોતાનો પાસપોર્ટ સાઈઝનો તાજતરનો ફોટો પરીક્ષા કેન્દ્ર પર લાવવાનો રહેશે. આ ફોટો ઉમેદવારનો પોતાનો છે તેની સ્પષ્ટતા માટે ફોટાવાળું ઓળખપત્ર સાથે રાખવું આવશ્યક છે.

ખાસ નોંધ :- પોસ્ટ ઓફિસમાં અરજી ફી ભરેલ નથી તેવા બિન અનામત કક્ષાના ઉમેદવારો પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે નહીં. આ ઉમેદવારોએ પ્રથમ આયોગની કચેરી, એરફોર્સ કચેરીની સામે, છ-૩ સર્કલ પાસે, 'છ' રોડ, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર ખાતે તા. ૧૭-૧૨-૨૦૧૬ સુધીમાં કચેરી સમય દરમિયાન રૂબરૂમાં આવી પ્રોસેસ ચાર્જ રૂ.૫૦૦/- રોકડેથી ભરવાના રહેશે. ત્યારબાદ જ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની પરવાનગી આપી શકાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

તા. ૦૩-૧૨-૨૦૧૬